

## તંદુરસ્ત જીવનશૈલી

આપણે સૌ જોઈએ છીએ કે દિન-પ્રતિદિન અવનવા રોગોનો ઉમેરો થતો જાય છે. કેન્સર, ડાયાબિટીસ, બલડપ્રેશર, હૃદયરોગ જેવા અનેક રોગો લોકોની ઝુંદગીનો એક ભાગ બની ગયા છે. આ દરેક રોગથી બચવા જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરવા એ જ ઉત્તમ ઉપાય છે.

### નીરોગી અને તંદુરસ્ત રહેવાની જડીબુઢી..

- સવારે વહેલાં ઉઠું અને રાત્રે વહેલાં સુધું.
- નિયમિત યોગ-પ્રાણાચામ અને કસરત કરવી.
- શારીરિક અને માનસિક તણાવ રહે એવા કાર્યો ન કરવા.
- થોડું ભુખ્યા રહેવું અને સમયાંતરે પાણી પીવું.
- ચરબી-ફેટનું પ્રમાણા વધારે હોથ તેવા જંક ફુડ અને માંસાહાર ન ખાવા.
- ખાંડ અને મીઠું પ્રમાણાસર ખાવું.
- તાજા શાકભાજી, ફળફળાદી અને રેસાવાળા ખોરાક વધુ પ્રમાણમાં ખાવા.
- ઓછામાં ઓછી ક કલાકની એકધારી ઊંઘ લેવી.
- બીડી, તમાકુ, સીગારેટ, દાડ જેવા વ્યસનોથી હંમેશા દુર રહેવું.
- સમયાંતરે શારીરિક તપાસ કરાવતા રહેવું.



# કેન્સર જાગૃતિ અભિયાન આયુર્ષ



- કેન્સરની પ્રાથમિક જાણકારી
- સ્ત્રીઓમાં સ્તન અને ગર્ભાશય કેન્સર વિશે જાણકારી
- મોટાંના કેન્સરની માહિતી
- વ્યસનોથી શરીર પર થતી ગંભીર અસરો
- તંદુરસ્ત જીવનશૈલીનું માર્ગદર્શન

જગશો જો સમયસર..  
તો કેન્સર પણ થઈ શકે છે કેન્સલ



હેઠ ઓફિસ : ડી-૭૦૭, ગાંધીશ મેરીડિયન, ગુજરાત હાઇકોર્ટની સામે, એસ.જી. હાઇવે, અમદાવાદ

હેલ્પલાઈન : +૯૧ ૭૦ ૯૬૯૬ ૯૨૯૨, ઈમેલ : [info @h wf-india.in](mailto:info@h wf-india.in),

બ્રાન્ચ ઓફિસ : પશુપતિ કોટસ્પીન એલએલપી, ટેગ્રેજ રોડ, બલાસર, કર્ણા,

રાજ્યસ્ટ્રેનન નં : CINU85191GJ2015NPL083151 Dt.: 07-05-2015



મેડિકલ કેન્સર સંથોગ : શયામ ઓન્કોલોજી ફાઉન્ડેશન | [www.shyamcancerfoundation.org](http://www.shyamcancerfoundation.org)



અજ્ઞાન એ જ શારીરિક અને માનસિક એવી સર્વ પ્રકારની તકલીફોનું મૂળભૂત કારણ છે,  
જ્યારે પેણાનિક ટબની જાણકારી સર્વ પ્રકારની સુખાકારીનું પ્રથમ સોપાન છે.

-મહિં ચરક

## કેન્સરની પ્રાથમિક જાણકારી

મિત્રો,

કેન્સરને જે જાણો છે તે તેની ગંભીરતાને પણ સમજે છે. તમે અત્યારે સોને ઉપયોગી થાય તેવી કેન્સર વિશે જાણકારી મેળવી રહ્યા છો. “કેન્સર દરેકને થઈશકે છે અને દરેક કેન્સરથી બચી શકે છે.” તેમાં ફર્ક છે માત્ર સમજણાનો અને જાણકારીનો. કેન્સરની કેટલીક માહિતી જોઈએ તો...

### કેન્સર એટલે કે...

શરીરનાં ગમે તે ભાગનાં પ્રાકૃતિક કોષોની અનિયમિત વૃદ્ધિ થઈને શરીરમાં ઘાતક અસરો ઉભી કરે તે કેન્સર. શરીરમાં લગભગ ૨૫૦ કરતાં પણ વધુ પ્રકારનાં કેન્સર થઈ શકે છે. પ્રાચીન સમયથી જ કેન્સર રોગ અસ્તિત્વમાં છે.

### કેન્સર એટલે કેન્સલની માન્યતા હવે કેમ ?

વીસમી સદીનાં અંત સુધી લોકોમાં કેન્સર એટલે કેન્સલની માન્યતા બંધાઈચુકી હતી. તેનું મુખ્ય કારણ હતું કે કેન્સરનું પ્રાથમિક તબક્કામાં નિદાન કરવું મુશ્કેલ હતું. પરંતુ અત્યારે આધુનિક વિજ્ઞાનની ધર્માબધી શોધોથી કેન્સરનું નિદાન ઝડપી થાય છે અને તેથી કેન્સર એટલે કેન્સલની માન્યતા બદલાઈ ચુકી છે. યોગ્ય જાણકારી અને તકેદારીથી આજે કેન્સર પર વિજ્ય મેળવી શકાય છે, છતાં સમજદારી તો સાવચેતીમાં જ છે....!!!!

### કેન્સર થયેલા દર્દીએ શું સાચવતું ?

- માનસિક રીતે મક્કામ રહીને હકારાતમક રીતે સારવાર કરાવવી.
- તમાકુ કે અન્ય વ્યસનને ત્યજી દેવાં.
- નિયમિત શારીરિક તપાસ અને ડૉક્ટરનાં સૂચન મુજબ જ સાવચેતી રાખવી.
- કેમોથેરાપી અને રેડીયોથેરાપીની સારવાર જરૂર પ્રમાણે સમયસર કરાવી લેવી.
- કેન્સરની અન્ય ઐક્લિપક સારવાર સર્ટિફિયાઇડ ડોક્ટર પાસે જ કરાવવી.

યાદ રાખો કે...જાગશો જો સમયસર તો કેન્સર પણ થઈ શકે છે કેન્સલ.

## સ્ત્રીઓમાં સ્તન અને ગબર્ભશાય કેન્સર વિશે જાણકારી

### સ્તનનું કેન્સર..

સ્ત્રીઓમાં સ્તન કેન્સરનાં કેસોનું પ્રમાણ ખૂબ જ વધુ છે. સ્ત્રી શરમ કે સંકોચનાં કારણે ધર્માબધ પોતાની તકલીફો કોઈને જણાવતી નથી. સ્તનમાં ગાંઠ હોવી તે અસાધારણ લક્ષણા છે, તેથી દરેક સ્ત્રીને સ્તન કેન્સરની જાણકારી હોવી જરૂરી છે. ભારતમાં દરવર્ષે સ્તન કેન્સરનાં ૧,૧૫,૦૦૦ નવા કેસો જોવા મળે છે તથા દર ૨૦માંથી ૧ મહિલાને જીવનકાળ દરમ્યાન સ્તન કેન્સરનો ભય રહે છે.

### સ્તન કેન્સરનાં સંભવિત કારણો..

- જે સ્ત્રીને પોતાનાં માતૃપક્ષમાં કોઈને ભૂતકાળમાં સ્તન કેન્સર થયું હોય.
- એક સ્તનમાં કેન્સર થયું હોય તેને બીજા સ્તનમાં થવાની શક્યતાઓ વધુ છે.
- જે સ્ત્રીએ બાળકનાં જન્મ પછી લાંબા સમય સુધી સ્તનપાન ન કરાવ્યું હોય.
- નાની ઊભરે માસિકધર્મની શરૂઆત કે મોટી ઊભરે માસિક બંધ થયું હોય.
- વધુ ચરબીવાળો ખોરાક ખાવાની આદત અને મેદસ્વી શરીર.
- જે સ્ત્રી મોટી ઊભરે માતા બની હોય અથવા બાળક ન થયા હોય.

### સ્તન કેન્સરનાં લક્ષણો

સ્તન : સ્તનમાં ગાંઠ હોવી

સ્તનની ચામડી ખરબચડી થવી.

સ્તનના આકારમાં ફેરફાર થવો.

સ્તન પર ચાંદુ પડવું.



કીટકી : કીટકી પર ચાંદુ પડવું અથવા ફોલ્ટી પડવી.

કીટકી અંદર જેંચાઈ જવી.

કીટકી માંથી લોહી નીકળવું.



બગલ : બગલમાં ગાંઠ હોવી.



ઉપરોક્ત તકલીફો જણાય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો.

### સ્તરનની જત તપાસ

દરેક સ્ત્રીએ પોતાની સ્વયં તપાસ અવશ્ય કરવી જોઈએ. સ્તરનની જત તપાસ નીચે જણાવ્યા મુજબ ત્રણ ચરણમાં કરવી જોઈએ.

### ૧ પ્રથમ (સ્નાન કરતી વખતે)

નહાતી વખતે આંગળીઓ સાબુના ફીણવાળી કરી સ્તરન પર હળવાં ભાર સાથે સરકાવીને તેમાં ગાંઠ છે કે નહીં તે ચકાસી જોવું.



### ૨ બીજું (સુતાં સુતાં)

આ તપાસમાં સ્ત્રીએ સીધાં સૂઈને ખભાનાં ચપટાં હાડકાં નીચે ઓશીકું રાખવું. જે સ્તરનની તપાસ કરી રહ્યા છો તે બાજુનાં હાથને માથા નીચે ઓશીકાની જેમ રાખી ટેવો. જેનાથી સ્તરનની દરેક માંસપેશીઓને બીજા હાથથી સરળતાથી તપાસી શકાય છે. આ રીતે બન્ને બાજુ વારાફરતી સ્તરનમાં ગાંઠ છે કે નહીં તે ચકાસી જુઓ.




સ્તરન તપાસ કરતી વખતે સ્તરન પર હાથની આંગળીઓને વર્તુળાકારે, ઉભી પછીની જેમ અને બહારથી અંદરની તરફ દબાવી દરેક બાજુથી તપાસ કરવી અને બન્ને સ્તરનની સરખામણીનો અનુભવ કરી લેવો. વિશેષ ગાંઠ કે અસામાન્ય ફેરફાર છે કે નહીં તે જોઈ લેવું.



### ૩ બીજુસ્ટેપ

અંતે, ડીટાને દબાવીને તેમાંથી લોહી, પડુ કે અસામાન્ય પ્રવાહી નીકળે છે કે નહીં તે જોઈ લેવું.



તમારું સ્વાસ્થ્ય અને તેની કાળજી તમારા જ હાથમાં છે.

### સ્તરનની જત તપાસ કેટલીવાર કરવી ?

જો સ્ત્રીને કોઈ તકલીફ નથી છતાં પણ ૨૦ વર્ષની ઉભર બાદ દર મહિને એકવાર સ્ત્રીએ સ્તરનની જત તપાસ કરી લેવી જોઈએ.

### ડૉક્ટર દ્વારા સામાન્ય તપાસ

- જીંદગીની રુંદ વર્ષની ઉભરમાં દર વર્ષે સ્તરન પરીક્ષણ ડૉક્ટર પાસે કરાવો.
- ડૉક્ટરની સલાહ પ્રમાણે મેમોટ્રાફી ટેસ્ટ કરાવવો.

### નોંધ :

- માસિક પુરું થયા બાદ ૭-૧૦ દિવસ બાદ અને મેનોપોઝમાં મહિનાના પહેલાં દિવસે જાતે સ્તરન પરીક્ષણ કરવું.
- જત તપાસ દરમ્યાન ગંઠો, ગાંઠ અથવા કોઈ અસાધારણ ફેરફાર અનુભવાય તો ગભરાશો નહિ. દરેક ગંઠો કે ગાંઠ કેન્સરકારક નથી હોતાં.

### ગર્ભશયનાં મુખનું કેન્સર

સ્ત્રીઓમાં સ્તરન કેન્સરની જેમ ગર્ભશયનાં મુખનું કેન્સરની પણ વધુ શક્યતાઓ રહે છે.



### ગર્ભશયનાં મુખનાં કેન્સરનાં લક્ષણો

- યોનીમાર્ગથી દુર્ગંધિત અને કાળ લોહી મિશ્રીત પ્રવાહી સતત નીકળતું રહેતું હોય.
- વારંવાર માસિકદર્મ (રકતસ્ત્રાવ) થતો હોય.
- મેનોપોઝનાં વર્ષો પછી અચાનક ગર્ભશયમાંથી લોહી નીકળો.

### ગર્ભશય કેન્સર કોને થઇ શકે છે ?

- જીંદગીની મોટી મહિલાને..
- સ્થૂળ-મેદસ્થી શરીર હોય..
- જે મહિલાએ હોર્મોન્સની સારવાર લીધી હોય..
- બાળક ન થયા હોય તેને..

### ગર્ભશય કેન્સરની તપાસ

પેપટેસ્ટ : જેમાં સ્ત્રીનાં યોગિમાર્ગમાંથી નીકળતાં પ્રવાહીની લેબોરેટરી તપાસ કરવામાં આવે છે. આ તપાસ કોઈપણ ગાયનેકોલોજીસ્ટ પાસે કરાવી શકાય છે.

કેન્સરનું સમયસર નિદાન અને સારવાર ઘણાં જીવન બચાવી શકે છે.

## મોંટાનું કેન્સર

હવે ગામે ગામ મોઢાંનાં કેન્સરનાં દર્દી અવશ્ય જોવા મળે જ છે. જેનું કારણ એ છે કે દરેક ગામમાં પ્રવેશતાં જ પહેલો ગલ્લો દેખાય ! લોકો ટોળે વળીને કેન્સર કરવાવાળી પડીકીઓને હસ્તા હસ્તા ખાય !

આજે સમગ્ર કેન્સર પૈકી મોંટાનાં કેન્સરનાં દર્દીઓનું પ્રમાણ ખૂબ જ વધારે છે. કેન્સરનાં કુલ કેસો પૈકી ૪૦% કેન્સર ફક્ત તમાકુ અને તેની બનાવટોથી થાય છે. જો તમે વ્યસન કરી રહ્યા છો તો તમે કેન્સરને આમંત્રી રહ્યા છો...!

## મોંટાનાં કેન્સરનાં લક્ષણો

- મોંટામાં લાલ કે સફેદ ચાંદુ પડે કે જે દવા કરાવવા છતાંચ કાબુમાં ન આવે.
- મોંટામાં ગાંઠ થવી તથા અંદરની ચામડીમાં ફેરફાર થવો.
- મોંઢું ખોલવામાં કે ખોરાક ગળવામાં તકલીફ થવી.
- કારણ વગર દાંત ફીલા પડી જવા.

## ચાદ રાખો...

### કેન્સરનું મુખ્ય કારણ છે વ્યસન..

સમગ્ર ભારતભરમાં થતાં જુદાં જુદાં કેન્સરમાં મોંનું કેન્સર અને ફેફસાનું કેન્સર મુખ્ય છે. જેનું કારણ માત્રને માત્ર વ્યસન છે. તમાકુ અને દાડ શરીરનાં દરેક કોષોને નુકશાન કરે છે અને તેની કેન્સર થવાની પ્રક્રિયાને ઉતેજે છે. પુરુષોનાં કુલ કેન્સરમાં ૪૦% અને સ્ત્રીઓમાં ૧૫% જેટલાં કેન્સર તમાકુ સાથે સંબંધિત છે.



તમાકુથી



મોંટાનું અને અન્નનણીનું કેન્સર,



બીડી, સીગારેટથી



ફેફસાનું કેન્સર



દાડથી



લીવરનું કેન્સર

સ્વસ્થ રહે પરિવાર..સુખ શાંતિ અપરંપાર..

## મોંટાનાં કેન્સરની જત તપાસ

તમને જો ઉપરોક્ત લક્ષણો જણાય તો ઘરે જ પોતાનાં મોંટાની તપાસ નીચે જણાવ્યા મુજબ કરી લેવી અને જરૂર જણાય તો ડૉક્ટરનો તુરંત જ સંપર્ક કરી લેવો.



સો પ્રથમ અરીસા સામે ઉભા રહો.



જુલની ડાબી બાજુ - ઉપરની બાજુ - જમણી બાજુ



ગાલની ડાબી બાજુ - તાણવું - ગાલની જમણી બાજુ



હોઠની દરેક બાજુએ તપાસ કરો

જાગ્યા ત્યારથી સવાર... આજે જ વ્યસન છોડો...